

COMMISSIONERATE OF HIGHER EDUCATION

Government of Gujarat

બિનસરકારી અનુદાનનત કોલેજના અધ્યાપક સહાયક ની જાહેરાત-૨૦૨૦ ના સંદર્ભ માં વારંવાર પુછાતા પ્રશ્નો (FAQ)

૧. એમ.ફીલ. ની લાયકાત ધરાવનાર ઉમેદવાર અથવા પીએચ.ડી.નો અભ્યાસ ચાલુ હોય તેવા ઉમેદવાર અરજી કરી શકે?

જવાબ. ના, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન રેગ્યુલેશન-૨૦૧૮ (તા.૧૮/૦૭/૨૦૧૮) પ્રમાણે ઉમેદવાર સંબંધિત વિદ્યાશાખામાં સંબંધિત વિષય સાથે અનુસ્નાતક કક્ષાએ લઘુત્તમ ૫૫% ગુણ સાથે અને સ્નાતક કક્ષાએ સારી શૈક્ષણિક કારકિર્દી ધરાવતા હોવા જોઈએ. તેમજ યુજીસી-સીએસઆઈઆર અથવા સમાન પ્રકારની સંસ્થા દ્વારા યોજાત NET (પ્રમાણપત્ર) અથવા સ્લેટ (પ્રમાણપત્ર) અથવા સેટ(પ્રમાણપત્ર) ઉત્તીર્ણ હોવા જોઈએ. ઉમેદવાર કે જેઓ University Grants Commission (Minimum Standards and Procedure for Award of Ph.D. Degree) Regulations, 2009/2016 અનુસાર પી.એચ.ડી લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારોને NET/ SLET લાયકાતમાંથી મુક્તિ મળવાપાત્ર છે.

૨. શૈક્ષણિક વર્ષ ૨૦૦૯ પહેલા કે તે બાદ મેળવેલ પીએચ.ડી.ની પદવી માન્ય છે ?

જવાબ: ઉમેદવારોએ University Grants Commission (Minimum Standards and Procedure for Award of Ph.D. Degree) Regulations, 2009 અનુસાર પી.એચ.ડી લાયકાત મેળવેલ છે તે મુજબનું યુનિવર્સિટીના સક્ષમ સત્તાધિકારીની સહી/સિક્કા વાળું કોમ્પ્લાયન્સ સર્ટીફિકેટ વેરીફિકેશન સમયે રજૂ કરવાનું રહેશે.

૩. પી.એચ.ડી થીસીસ જમા કરાવેલ હોય પરંતુ બાકીની પ્રક્રિયા બાકી હોય તેવા ઉમેદવાર અરજી કરી શકશે?

જવાબ: ના, ઉમેદવાર પાસે યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલ પી.એચ.ડી.ની ડીગ્રી એનાયત કરવા માટેનું નોટીફિકેશન હોવું આવશ્યક છે.

૪. મહત્તમ કેટલી કોલેજો માટે પસંદગી ક્રમ આપી શકાય ?

જવાબ: આપના વિષય અને કેટેગરી મુજબની તમામ કોલેજો માટે પસંદગી ક્રમ આપી શકાશે.

૬. અનામત કક્ષાના ઉમેદવારે બિનઅનામત કક્ષાનો લાભલેવા અલગ ફોર્મ ભરવું પડશે ?

જવાબ: ના, કોઈ પણ અનામત કક્ષાના ઉમેદવારે એક વિષય માટે ફક્ત એક જ ફોર્મ ભરવાનું રહેશે.

૭. શાળાના શિક્ષક તરીકેનો અનુભવ માન્ય ગણાશે ?

જવાબ: ના, ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની કચેરીના આ અંગેના પરિપત્ર મુજબ ફક્ત સરકારી કોલેજો/બિનસરકારી અનુદાનિત કોલેજો/યુનિવર્સિટીમાં વ્યાખ્યાતા સહાયક કે બિન અનુદાનિત (યુનિવર્સિટી માન્ય સંસ્થા)માં આસિ.પ્રોફેસર/વ્યાખ્યાતા સહાયક કે અધ્યાપક સહાયક તરીકેનો અનુભવ જ માન્ય ગણાશે. બિન અનુદાનિત સંસ્થાઓમાં જો અનુભવ મેળવેલ હોયતો યુ.જી.સી. રેગ્યુલેશન-૨૦૧૮ ના પેરા-૧૦.૦ મુજબની શરતોનું પાલન થવું જરૂરી છે.

૮. ૨૦૦૯ પહેલાં પી.એચ.ડી. કરેલ છે તો શું મારે કોમ્પ્લાયન્સ સર્ટી. મેળવવું પડશે?

જવાબ: હા

૯. હું સેલ્ફાઈનાન્સ કોલેજમાં અધ્યાપક છું તો મારો અનુભવ ધ્યાને લેવાશે?

જવાબ: હા, પરંતુ યુ.જી.સી. રેગ્યુલેશન-૨૦૧૮ ના પેરા-૧૦.૦ મુજબની શરતોનું અને ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રીની કચેરીના આ અંગેના પરિપત્ર મુજબ પાલન થવું જરૂરી છે.

૧૦. અધ્યાપક સહાયક તરીકે હાલમાં કાર્યરત છું તો શું હું અરજી કરી શકું?

જવાબ: હા, હાલની સંસ્થા પાસેથી 'ના વાંધા પ્રમાણપત્ર' મેળવીને વેરિફિકેશન તથા મૌખિક ઈન્ટરવ્યુ સમયે તે રજૂ કરવાનું રહેશે.

૧૧. હું NET પાસ છું તો અરજી કરી શકું?

જવાબ: હા, પરંતુ NET સંબંધિત વિષયમાં પાસ કરેલ હોવું જોઈએ અને અનુસ્નાતક કક્ષાએ સંબંધિત વિષય અને વિદ્યાશાખામાં ૫૫% મેળવેલા હોવા જરૂરી છે.

૧૨. મે પી.એચ.ડી. કરેલ છે તો શું હું અરજી કરી શકું?

જવાબ: હા, પરંતુ પી.એચ.ડી. સંબંધિત વિષયમાં કરેલ હોવું જોઈએ અને અનુસ્નાતક કક્ષાએ સંબંધિત વિષય અને વિદ્યાશાખામાં ૫૫% મેળવેલા હોવા જરૂરી છે.

૧૩. મારો અભ્યાસ ગુજરાત બહાર થયો છે તો મારે ડોમિસાઈલ મેળવવું પડશે?

જવાબ: ના

૧૪. અરજી કરવાની છેલ્લી તારીખ પછી મારી ડીગ્રી આવે તો ઈન્ટરવ્યુ પહેલા જમા કરાવી હું ઉમેદવારી કરી શકું?

જવાબ: ના, અધ્યાપક સહાયક માટેની લઘુત્તમ લાયકાતો અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં મેળવેલા હોવાં જોઈએ.